https://archive.org/details/bk787/page/n0/mode/1up

1951-10-03 -Azad Kutch -Newspaper (787)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

...પ્રસીધ્ધ થતું ... વડેચાંતા ... પત્ર ... વધુ વંચાતુ અને પ્રથમ દૈનીક : Reg. BNo 5717

# આઝાદ કચ્છ

તંત્રી પ્રાણલાલ શાહ

વર્ષ ૨ અંક ૬૬૬ મો | બુધવાર તા. ૩-૧૦-૧૯૫૧ | પાનાં ૪ છુટક નકલ કિંમત ૦॥ આનો

# ચુંટણી નિષ્પક્ષપાતપણે થવી જોઇએ

# બેદરકારી માટે અફસરો સજાને પાત્ર ઠરશે

## આગામી ચુંટણી અંગે તઈયાર રહેવા કચ્છનાં કર્મચારીઓને વડાહાકેમનો આદેશ

**ચુંટણીને લગતી દરેક કામગીરી બીલકુલ નીષ્પક્ષપાતપણે થવી જોઇએ અને એ દરેક સરકારી નોકરની કાયદેસર ફરજ છે. સરકાર તેમના તરફથી આવી નીષ્પક્ષપાત કામગીરીની આશા સેવે છે.**

આગામી સામાન્ય ચુંટણી અંગે કચ્છ સરકારનાં તમામ કર્મચારીઓને કેટલીક સુચના આપતા પણ કચ્છનાં વડા હાકેમ શ્રી ધારગેએ મોકલતાં ઉપર પ્રમાણે જણાવ્યું છે.

તેમણે આગામી ચુંટણી અંગેની ચાલી રહેલી તઇયારી અને નીયત થઇ જનારા સમયનો ઇશારો કરી એ ચુંટણીને પહોંચી વળવા વહીવટી તંત્રને તઇયાર રહેવા અને દુનીયાભરમાં અજોડ આઝાદ હીંદની આ ચુંટણી સરળતા પુર્વક પુર્ણ કરવાની તઇયારી કરવા અનુરોધ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે દુનીયાભરમાં અજોડ એવી આ ચુંટણી છે. અને એ સફળતાથી પાર પડે તેનાં પર આપણા ભારત દેશની પ્રતીષ્ઠા આધારેલી છે અને તે કારણે દરેક અધીકારીએ તનતોડ મહેનત કરી તેને સફળ બનાવવી પડશે.

તેમણે કહ્યું છે ચુંટણીને લગતી દરેક કામગીરી બીલકુલ નીષ્પક્ષપાત પણે થવી જોઇએ. અને એ દરેક સરકારી નોકરની કાયદેસર ફરજ છે. અને સરકાર તેમના તરફથી આવી નીષ્પક્ષપાત કામગીરીની આશા રાખે છે.

તેમણે ચુંટણી અંગેનાં અમલદારોને ચુંટણી અંગેનાં કાર્યનું જ્ઞાન મેળવી વાકેફ રહેવા અનુરોધ કર્યો છે. અને મતદારોને યોગ્ય રીતે તઇયાર કરવા કલેકટર જેઓ ચીફ ઇલેકટોરલ ઓફીસર સાહેબ તરફથી જે સુચનાઓ પ્રસંગોપાત મળતી રહે તે પ્રમાણે પ્રબંધ કરવો જોઇએ.

ચુંટણી પુરી થતાં સુધી ચુંટણીને લગતી તમામ કામગીરીને પ્રથમ દરજ્જાની કામગીરી ગણી કશો જ વીલંબ ન થાય એ જોવા અનુરોધ કર્યો છે.

તેમણે એ પત્રમાં જણાવ્યું છે કે ચુંટણીના કાર્યમાં જે અધીકારી વીશેષ કાર્ય દક્ષતા દર્શાવશે તેની યોગ્ય નોંધ લેવામાં આવશે અને તેની જ રીતે આ કાર્યમાં દર્શાવેલી બેદરકારી અને બીન આવડત માટે તેને શીક્ષાપાત્ર ગણવામાં આવશે.

આઝાદ કચ્છ

દિપોત્સવી અંક
ઝડપભેર તૈયાર થઇ રહ્યો છે.

જાહેર ખબરના ભાવો

આઝાદ કચ્છનું

| | |
|---|---|
| આખું પેઇજ | ૪૮-૦-૦ |
| અર્ધું પેઇજ | ૨૪-૦-૦ |
| પા પેઇજ | ૧૨-૦-૦ |

વધુ પુછપરછ માટે
આજે જ તપાસ કરો

: વ્યવસ્થાપક :
જાહેર ખબર વીભાગ
આઝાદ કચ્છ
ભુજ—કચ્છ

## તંત્ર પર વર્ચસ્વ જમાવવાના પુરાણા પ્રયાસ?

### પાટનગરની ચોરી પુર્વ યોજીત છે?

ભુજ

પાટનગરમાં સરકારી તીજોરીવાળા લતામાંથી સ્વ. ગુલાબશંકર શોમજીનાં ઘરમાંથી થયેલી સનસનાટીભરી ચોરી કચ્છનાં પોલીસ તંત્રને પડકારરૂપ બની ગઇ છે. ચોરી થવાને કલાકો અને દીવસો વીતી ગયા છે પરંતુ ચોરનો પત્તો હજુ પોલીસને સાંપડયો નથી.

પોલીસતંત્રનાં અનુભવીઓ આ ચોરીને એક પુર્વયોજીત કાવતરું ગણાવે છે અને ભુજ તંત્રમાં પોતાનું વર્ચસ્વ વધુને વધુ ધીંગું બનાવી રહેવાનાં ભુતકાળમાં થયેલા અનેકાનેક બનાવનું ફરી પુનરાવર્તન થતું ગણાવાય છે.

— એક વર્ગ આ ચોરીને એક પડકાર સમાન ગણાવે છે સામાન્ય ચોરીઓ પાટનગરમાં અનેક થઇ છે ભાગેજનો પત્તો સાંપડયો હોવાનું બહાર આવ્યું છે. આ ચોરી એક કોમીના કુંટુંબમાંથી થઇ છે અને વળી જ્યાં સરકારી તીજોરી રહે છે. તે લતામાંથી કરાઇ છે. એ સુચક ગણાવાય છે.

એક વર્ગ એમ માને છે કે આ ચોરી સત્વર હાથ કરવા હમણુ થાય એ સ્વાભાવીક છે. પરંતુ શહેર પોલીસ આ ચોરી હાથ કરી શકે એમ નહોય, યુકિતપુરસ. એ ચોરી શોધી આપવાની અને ચશ કલગી ની કામગીરી સાથે લેવાની યોજના પણ હોય તો તેમાં આશ્ચર્ય જેવું માનું નથી.

પોલીસ વડા ભુચનાં તંત્રથી જનતાને કોઇ સહીસલામતી સાંપડી નથી. લુંટો કે ચોરીઓ અટકી નથી. રૂશ્વત અને જુલ્મો અટકયા નથી. અંતરીક ખટપટ, શીસ્તનો અભાવ કે કીન્નાખોરી ઘટી નથી તંત્રમાં કોમવાદ વીકસતો દેખાય છે અને પુરાણા અળખામણા માનવીઓનાં હાથમાં તંત્રનો દોર સદંતર સરી રહયો દેખાય છે.

### ખલાસ થઇ ગયેલા મોલ

સાંયરા (યક્ષવાળા)

અત્રે પ્રથમથી જ વરસાદ ન થવાથી ખેતરોમાં જે કોઇ મોલ હતો તે પણ વરસાદના અભાવે ખલાસ થઇ ગયો છે. વાડીઓના બાજરાની કાપણી ચોમાસ પછી થવાની શકયતા છે.

અંજારમાં ઈતિહાસ રચતું ચિત્ર

# જાદુ

જ્યાં માનવ મહેરામણ ઉલટે છે.
સોહીની ભર્યું રૂપ અને મદભરી આંખોથી
નલીની જયવંત જાદુ જમાવે છે
દબદબા ભરી નૃત્ય સવારીના અનેક દીલચસ્પ દશ્યોનું
મોકનંને પડદે આકર્ષણ જમાવે છે.

મોડર્ન ટોકીઝ — અંજાર-કચ્છ

realpatidar.com

https://archive.org/details/bk787/page/n1/mode/1up

# Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

## About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 4.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.19 15:44:41 +05'30'



See Page 4

realpatidar.com

કચ્છમાં પ્રસીદ્ધ થતું [illegible] અને પ્રથમ દૈનીક : Reg. BNo 5717

# આઝાદ કચ્છ

તંત્રી પ્રાણલાલ શાહ

વર્ષ ૨ અંક ૬૬૬ મો | બુધવાર તા. ૩-૧૦-૧૯૫૧ | પાનાં ૪ છુટક નકલ કિંમત ૦।। આનો

# ચુંટણી નિષ્પક્ષપાતપણે થવી જોઇએ

## બેદરકારી માટે અફસરો સજાને પાત્ર ઠરશે

### આગામી ચુંટણી અંગે તઈયાર રહેવા કચ્છનાં કર્મચારીઓને વડાહાકેમનો આદેશ

ચુંટણીને લગતી દરેક કામગીરી બીલકુલ નીષ્પક્ષપાતપણે થવી જોઇએ અને એ દરેક સરકારી નોકરની કાયદેસર ફરજ છે. સરકાર તેમના તરફથી આવી નીષ્પક્ષપાત કામગીરીની આશા સેવે છે.

આગામી સામાન્ય ચુંટણી અંગે કચ્છ સરકારનાં તમામ કર્મચારીઓને કેટલીક સુચના આપતા પણ કચ્છનાં વડા હાકેમ શ્રી ધાટગેએ મોકલતાં ઉપર પ્રમાણે જણાવ્યું છે.

તેમણે આગામી ચુંટણી અંગેની ચાલી રહેલી તઇયારી અને નીયત થઇ જનારા સમયનો ઇશારો કરી એ ચુંટણીને પહેલ્થી વળવા વહીવટી તંત્રને તઇયાર રહેવા અને દુનીયાભરમાં અજોડ આઝાદ હીંદની આ ચુંટણી સરળતા પુર્વક પુર્ણ કરવાની તઇયારી કરવા અનુરોધ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે દુનીયાભરમાં અજોડ એવી આ ચુંટણી છે. અને એ સફળતાથી પાર પડે તેના પર આપણા ભારત દેશની પ્રતીષ્ઠા આધારેલી છે અને તે કારણે દરેક અધીકારીએ તનતોડ મહેનત કરી તેને સફળ બનાવવી પડશે.

તેમણે કહ્યું છે ચુંટણીને લગતી હરેક કામગીરી બીલકુલ નીષ્પક્ષપાત પણે થવી જોઇએ. અને એ દરેક સરકારી નોકરની કાયદેસર ફરજ છે. અને સરકાર તેમના તરફથી આવી નીષ્પક્ષપાત કામગીરીની આશા રાખે છે.

તેમણે ચુંટણી અંગેના અમલદારોને ચુંટણી અંગેના કાર્યનુ જ્ઞાન મેળવી વાકેફ રહેવા અનુરોધ કર્યો છે. અને મતદારોને યોગ્ય રીતે તઇયાર કરવા કલેકટર જેઓ ચીફ ઇલેકટોરલ ઓફીસર સાહેબ તરફથી જે સુચનાઓ પ્રસંગોપાત મળતી રહે તે પ્રમાણે પ્રબંધ કરવો જોઇએ.

ચુંટણી પુરી થતાં સુધી ચુંટણીને લગતી તમામ કામગીરીને પ્રથમ દરજ્જાની કામગીરી ગણી કશો જ વીલંબ ન થાય એ જોવા અનુરોધ કર્યો છે.

તેમણે એ પત્રમાં જણાવ્યું છે કે ચુંટણીના કાર્યમાં જે અધીકારી વીશેષ કાર્ય દક્ષતા દર્શાવશે તેની યોગ્ય નોંધ લેવામાં આવશે અને તેવી જ રીતે આ કાર્યમાં દર્શાવેલી બેદરકારી અને બીન આવડત માટે તેને શીક્ષાપાત્ર ગણવામાં આવશે.

આઝાદ કચ્છ

દિપોત્સવી અંક
ઝડપભેર તૈયાર થઇ રહ્યો છે.

જાહેર ખબરના ભાવો

આઝાદ કચ્છનું

| | |
|---|---|
| આખું પેઇજ | ૪૮-૦-૦ |
| અડધું પેઇજ | ૨૪-૦-૦ |
| પા પેઇજ | ૧૨-૦-૦ |

વધુ પુછપરછ માટે
આજે જ તપાસ કરો

: વ્યવસ્થાપક :
જાહેર ખબર વીભાગ
આઝાદ કચ્છ
ભુજ—કચ્છ

## તંત્ર પર વર્ચસ્વ જમાવવાના પુરાણા પ્રયાસ?

### પાટનગરની ચોરી પુર્વ યોજીત છે?

ભુજ

પાટનગરમાં સરકારી તીજોરીવાળા લતામાંથી સ્વ. ગુલાબશંકર શોમજીના ઘરમાંથી થયેલી સનસનાટીભરી ચોરી કચ્છનાં પોલીસ તંત્રને પડકારરૂપ બની ગઇ છે. ચોરી થવાને કલાકો અને દીવસો વીતી ગયા છે પરંતુ ચોરનો પત્તો હજુ પોલીસને સાંપડયો નથી.

પોલીસતંત્રનાં અનુભવીઓ આ ચોરીને એક પુર્વયોજીત કાવતરું ગણાવે છે અને ભુજ તંત્રમાં પોતાનું વર્ચસ્વ વધુને વધુ ઘીગું બનાવી રહેવાનાં ભુતકાળમાં થયેલા અનેકાનેક બનાવનું ફરી પુનરાવર્તન થતું ગણાવાય છે.

એક વર્ગ આ ચોરીને એક પડકાર સમાન ગણાવે છે સામાન્ય ચોરીઓ પાટનગરમાં અનેક થઇ છે ભાગ્યેજ તેનો પત્તો સાંપડયો હોવાનું બહાર આવ્યું છે. આ ચોરી એક કારોબારીના કુટુંબમાંથી થઇ છે અને વળી જ્યાં સરકારી તીજોરી રહે છે. તે લતામાંથી કરાઇ છે. એ સુચક ગણાવાય છે.

એક વર્ગ એમ માને છે કે આ ચોરી સત્વર હાથ કરવા હમણા થાય એ સ્વાભાવીક છે. પરંતુ શહેર પોલીસ આ ચોરી હાથ કરી શકે એમ નહોઇ, યુકિતપુરસ્સર એ ચોરી શોધી આપવાની અને યશ કલગી નવી કામગીરી સાથે લેવાની યોજના પણ હોય તો તેમાં આશ્ચર્ય જેવું માનવું નથી.

પોલીસ વડા ભુચનાં તંત્રથી જનતાને કોઇ સહીસલામતી સાંપડી નથી. લુંટો કે ચોરીઓ અટકી નથી. રુશ્વત અને જુલ્મો અટકયા નથી. અંતરીક ખટપટ, શીસ્તનો અભાવ કે કીન્નાખોરી ઘટી નથી તંત્રમાં કોમવાદ વીકસતો દેખાય છે અને પુરાણા અળખામણા માનવીઓનાં હાથમાં તંત્રનો દોર સદંતર સરી રહયો દેખાય છે.

### ખલાસ થઇ ગયલા મોલ

સાંયરા (યક્ષવાળા)

અત્રે પ્રથમથી જ વરસાદ ન થવાથી ખેતરોમાં જે કાંઇ મોલ હતો તે પણ વરસાદના અભાવે ખલાસ થઇ ગયો છે. વાડીઓના બાજરાની કાપણી જમાસ પછી થવાની શકયતા છે.

અંજારમાં ઈતિહાસ રચતું ચિત્ર

જાદુ

જ્યાં માનવ મહેરામણ ઉલ્ટે છે.
શાહીની ભર્યું રૂપ અને મદભરી આંખોથી
નલીની જયવંત જાદુ જમાવે છે
હબહબા ભરી નૃત્ય સવારીના અનેક દીલચસ્પ દ્રશ્યોનું
મોહનને પડદે આકર્ષણ જમાવે છે.

મોડર્ન ટોકીઝ અંજાર-કચ્છ

realpatidar.com

https://archive.org/details/bk787/page/n3/mode/1up

1951-10-03 -Azad Kutch -Newspaper (787)

realpatidar.com



[illegible]

તા. ૩-૧૦-૫૧

## એકાયદા કૃત્યોની તપાસ આપો

ગેલા રવીવારે મુંબઈથી માંડવી આવેલા સ્ટીમર સરસ્વતીનાં પ્રવાસી ઓની થયેલી ભયંકર પરેશાની, એકાયદા ચુંથણી અને સતામણી, આજનાં યુગમાં પણ સુતરીયાઓ ... આપખુદ અધીકારીઓ વસે છે તેની યાદ દેવડાવે છે.

પ્રવાસીઓની જડતી અધીકારીએ કરેલી ચુંથણી સદંતર બેકાયદા જ હતી. અને એટલુંજ બેકાયદા કૃત્ય, સુતરીયાનાં પુત્રીનું ...તું. સુતરીયાનાં પુત્રી કાંઈ સ... ર જકાતી અધીકારી નથી, અને એમ હતાય, સ્ત્રીઓના સન્માન ... નહીં પરંતુ અંગ ... પણ એ લેશે. એ અમને ભય છે કે ગંભીર અનીષ્ટ સર્જાવી રહેશે. સુતરીયાનાં પુત્રીની આપખુદીનો જો કોઈ સામનો કરશે અને તેમાં તેની બેઅદબી થશે તો તેનું એક માત્ર કારણ સુતરીઆ પોતેજ હશે.

માંડવીની પોલીસે ભલે સુતરીયાની સુચના ..., પણ જે લાઠીઓ ... છે. ... ના કુંદાઓ વાપર્યા છે, એ ગંભીર તપાસ માગી લે છે. અનેકવારે ત્યારે લાઠીનો ઉપયોગ કરી રહેલી પોલીસને એ ખરેખર સમજાવવાની જરૂર છે કે લાઠીનો ઉપયોગ ક્યારે થઈ શકે

પ્રવાસીઓ ત્રણ ત્રણ કલાક ધુમ તડકામાં ... વગર તરફડતાં કેમ બેઠી રહ્... થી પણ અમને આશ્ચર્ય થાય છે સુ... ની આપખુદીનો એક પ્રવાસીએ ... સામનો ... એજ રીતે બીજા પ્રવાસીઓએ કરવો જરૂરી હતો. અને છે કોઈ એક શકદારનો સામાન તપાસવાની જરૂર હોય તો તેમાં પ્રવાસીઓએ પોતે જ સહકાર આપવો જોઈએ પરંતુ જ્યાં કલાક એકાયદા રીતે તેમને ચુંથવામાં આવતા હોય તો તેનો સદંતર ઈન્કાર કરી તે જ વખતે બીજા ઉપરી અધીકારીઓને તારો કરી અને બીજા ... ધનો કરવા. આ ... યદા ... અને જંગાલીયતમાં ... કરવા કમાણ કરવું જોઈએ.

---

'આ ઝા દ ક ચ્છ 'ના

# સ્પોર્ટસ વિભાગ

સંપાદકઃ 'પંકજ'

## ગાંધીધામ ટીમના ખેલાડી અજવાણીએ બતાવેલી ઝમકદાર રમત

# ડ્રોમાં ગયેલી ગાંધીધામ ભુજ વચ્ચેની આકર્ષક ક્રિકેટ મેચ

તા. ૩૦ સપ્ટેમ્બર રવીવારે ... નગરમાં એક યાદગાર પ્રસંગ, સ્પોર્ટ શોખીનોએ અનુભવ્યો હતો. જે મેચની લાંબા સમયથી રાહ જોવાતી હતી. એ ગાંધીધામ ક્રીકેટ કલબ અને આલ્ફ્રેડ હાઈસ્કુલ ક્રીકેટ ટીમ વચ્ચેની મેચ જ... ...લી ગ્રાઉન્ડ પર રમાઈ હતી.

આ યાદગાર મેચનો આખો અહેવાલ તો જો આપવામાં આવતો તે, બહુ લાંબો થાય. પરંતુ જો ટુંકમાં અહેવાલ લેવાય તો પણ ઠીક રસદાયક બને તેમ છે.

ભુજની આલ્ફ્રેડ ક્રીકેટ ટીમના કેપ્ટન, જા...તા શ્રી. ચુનીલાલ ઠક્કર હતા. જ્યારે ગાંધીધામ ટીમના કેપ્ટન શ્રી ભાગીઆ હતા.

સવારે ૯ વાગ્યે ટોસ ફેંકવામાં આવ્યો હતો. ટોસ ગાંધીધામ ટીમ જીતી હતી, ગાંધીધામે ફીલ્ડીંગ લેવાનું પસંદ કર્યું હતું ભુજની ટીમ તરફથી અબ્દુલા અને લછુરામે ઓપનીંગ કરી હતી. લછુરામે રમતમાં જરા ઝમક દેખાડવા માંડી હતી પરંતુ ૧૧૨ ને તે બોલ્ડ થયા હતા. બાદ કચ્છની ક્રીકેટની જે આશા સામાન છે અને જેનું ભવીષ્ય બહુ ઉજળું છે તે ગુણવંતરાય આવ્યા અને અબ્દુલા સાથે તેણે ૪૬ રનની પાર્ટનરશીપ કરી હતી. અબ્દુલાએ મહેનત કરી હતી પરંતુ છતાં તે ૨૧ રને તે આઉટ થયા હતા.

આ પછી બોરાકીશન આવ્યા હતા અને તેઓ ૨૯ સારા રન કરી પાછા આવ્યા હતા. આ પછી ટીમ ફકત ૨૫ રનની અંદર ખખડી પડી હતી.

ગુણવંતરાય (દાદા)એ ૫૨ રન કરીને રંગ રાખ્યો હતો. હાઈસ્કુલની ટીમે ૧૪૪ રન કર્યા હતા. ૧૨ ને ૫૦ મીનીટે ગાંધીધામે બેટીંગ લેવાનું શરૂ કર્યું અને ગાંધીધામના પ્લેયર નાયસંગાણીએ શરૂઆત કરી હતી. પરંતુ માત્ર ૭૦ મીનીટમાં જ પાંચ ખેલાડીઓ કાતીલ બોલરો પીનારા અને ગુણવંતરાય સામે ઉભી શકયા નહોતાં. તેઓએ ૨૪ રનમાં ૫ વીકેટ ગુમાવી હતી અને લંચ પડયો હતો.

૩-૪૫ મીનીટે ફરીથી શરૂઆત થઈ હતી. અને અજવાણીએ ૪૬ રન કરી રમત પોતાના ખભા પર ઉપાડી લીધી હતી. અજવાણીએ ખરેખર બહુ સરસ રમત ખેલી હતી. જો તે બરાબર નહીં રમ્યા હોત તો ગાંધીધામ ટીમનો દેખાવ બહુ ખરાબ થવા સંભવ હતો.

### બન્ને ટીમના ખેલાડીઓ

| ભુજ | ગાંધીધામ |
|---|---|
| ચુનીલાલ (કેપ્ટન) | ભાગીઆ |
| ગુણવંતરાય | સાધાણી |
| પીનારા | તીરથદાસ |
| અબ્દુલ્લા | નીહાલાની |
| પુષ્પકાન્ત | જમતીઆની |
| કીશનચંદ | રાયસંઘાની |
| ચંદ્રસીંહજી | પટેલ |
| બંકીમચંદ્ર | અજવાની |
| હરવદન | શહાણી |
| લચ્છુરામ | આનંદરામ |
| ધીરજલાલ | માલાની |

પીનારા અને ગુણવંતરાયે દરેકે ચાર-ચાર વીકેટો લઈ ગાંધીધામ ટીમનો કરૂણાજનક નાખી હતી. પેવેલીયનમાંથી અને મેદાનની ચારેબાજુએ એકઠા મળેલા વીદ્યાર્થીઓમાં અને રમત શોખીનોમાંથી ખેલ દીલી પુર્વક આનંદના ઉદ્ગારો અને તાળીઓના ગડગડાટ થયા કરતા હતા.

૭૪ રન આગળ રહેલી ભુજની ટીમે દાવ લેવો શરૂ કર્યો હતો. અબ્દુલ્લા અને કીશનચંદથી દાવ લેવા શરૂ કર્યા હતા.

ઘણી ફાસ્ટ રમવાની જરૂર હતી. પણ તેઓ ફાસ્ટ ન રમી શકયા અને ૨ વીકેટ થોડા રને ગુમાવ્યા પરંતુ ત્યારબાદ કેપ્ટન ચુનીલાલ અને પુષ્પકાંતે ફટકાબાજી કરી અને ત્રણ વીકેટના ભોગે ૬૨ રને દાવ ડીકલેર હાઈસ્કુલે કર્યો હતો.

હાઈસ્કુલના નામાંકીત ખેલાડીઓએ કેચીસ ડ્રોપ કર્યા એ આશ્ચર્યકારક લાગતું હતું જ્યારે બીજીઈનીંગમાં ગાંધીધામે ફટકાબાજીની શરૂઆત કરી હતી. પરંતુ મેચ ડ્રોમાં ગઈ હતી.

આખીયે મેચ દરમ્યાન બન્ને ટીમોનાં ખેલાડીઓનું વલણ ખેલ દીલી ભર્યું રહ્યું હતું.

આ મેચ જોવા ઉચ્ચ અમલદારો સહીત મોટી સંખ્યામાં ... અને વીદ્યાર્થીઓ હાજર રહયા હતા, એથી એ સાબીત થતું હતું કે સ્પોર્ટસનું સ્થાન દીવસે દીવસે ઉંચું ચઢતું જાય છે.

આખી મેચની વ્યવસ્થા ગોઠવવામાં આલ્ફ્રેડ હાઈસ્કુલના અત્યારના હેડ માસ્તર શ્રી ડોલરરાયભાઈએ ભુખજ પરીશ્રમ ઉઠાવ્યો હતો. અત્યાર સુધી એમના જેટલી મહેનત અને સહકાર કોઈપણ શીક્ષકે આપ્યાનો આ પહેલોજ પ્રસંગ હતો.

ગાંધીધામના ખેલાડીઓ સાથે જતી સમયે ભુજની ટીમના કેપ્ટન શ્રા. ચુનીલાલે બધા સાથે હસ્તધુનન કર્યું હતું. ગાંધીધામ ટીમના કેપ્ટન શ્રી. ભાગીઆએ ભુજની ટીમને ગાંધીધામ આવવા આગ્રહ ભર્યું નામંત્રણ આપ્યું હતું અને દીવાળી પહેલાં આવવા ખાસ સુચવ્યું હતું. એમણે ગાંધીધામમાં બધી જ સગવડો સચવાશે તેની ખાત્રી પણ આપી હતી.

ભુજની ટીમ ગાંધીધામ જવાનું ક્યારે વધુ સમરકંદ ... થશે તે અંગે વીચારણા ચલાવી રહી હોવાની માહિતી મળે છે.

---

નવા ચલાવનારા ખારવા ભાઈઓની સતામણી માટે માંડવીના ખારવા મંડળે અને આ પ્રશ્ન ખાસ માંડવીના વધુ કોઈ સ્થાનિક કાર્યકરોએ ઉપાડી લેવો ઘટે છે.

'સરસ્વતી'નાં પ્રવાસીઓ પર ગુજરેલા એકાયદા અત્યાચાર અને સતામણીની કડક તપાસ, ઉચ્ચ સત્તાવાળાઓ પાસેથી અમે માંગીએ છીએ.

---

## માંડવી જનારી ભુજની યંગર (જુનીયર) ટીમ

ભુજ

એવી માહીતી મળે છે કે ભુજની આલ્ફ્રેડ હાઈસ્કુલની યંગર (જુનીયર) ક્રીકેટ ટીમ માંડવીના ખેલાડીઓ સાથે મેચ લેવાનું વીચારી રહી છે. અને આ સંબંધે વાતચીત ચાલી રહી છે અને આ સપ્તાહનાં રવીવારે માંડવી-ભુજ વચ્ચેની મેચ યોજાય તેવો સંભવ છે.

realpatidar.com

https://archive.org/details/bk787/page/n4/mode/1up



realpatidar.com

અન્ન પ્રધાન શ્રી મુનશીએ સંસદમાં જાહેર કર્યું છે કે કચ્છમાં પાસ માસ ચાલે તેટલો અનાજનો જથ્થો છે.

બીહારમાં જ્યારે ભયંકર દુષ્કાળ પ્રવર્તતો હતો. અને હજારોબંધ માણસો અનાજની તંગીને કારણે જ મરણ પામતા હતા ત્યારે બીહારમાં દુષ્કાળ છે જ નહીં કે અનાજની તંગી છે જ નહીં એવું હળાહળ-જુઠાણું મુનશીજીએ વહેતુ કર્યું હતું. કચ્છની બાબતમાં પણ એ જ વાતનું પુનરાવર્તન દુષ્કાળ પ્રધાન કરતા નથીને?

અબડાસાના કોંગ્રેસી આગેવાનોએ વરસાદની અછતને કારણે ઉભી થયેલી પરીસ્થીતી 'પ્ર-ત્ય-ક્ષ' નીહાળવા વીસ્તૃત પ્રવાસ કર્યો હતો.

કોંગ્રેસી આગવાનો પાસે પ્રવાસ સીવાય બીજી કઈ આશા જનતા રાખી પણ શકે તેમ છે?

લોકોમાં જાગૃતી આણવાની જવાબદારી કોંગ્રેસની છે. પણ એ સંસ્થા પોતે પણ હજી ચુંટણી અંગે ગરમ થઈ નથી.

ગરમ થઈને બીજું હવે શું કરે? એક બીજા સાથે ચુંટણીની ઉમેદવારી અંગે કોંગ્રેસીઓ વઢે તો છે જ, હવે તો ખુન કરે એ જ બાકી છે!

કાપડની અનીચારી વહેંચણી

કચ્છમાં માત્ર કાપડની જ અનીચારી વહેંચણી છે એમ નથી, મારા ભાઈ! અનાજની, હોદાની, સત્તાની અને રાજકરણમાં કોંગ્રેસીઓ વચ્ચે શુધ્ધીની પણ અનાચારી વહેંચણી જ થયેલી નજરે પડે છે.

આર્થીક કટોકટીમાં મુકાઈ ગયેલું સાધીધામનું રચનાકાર્ય! નોકરોને છુટા કરવાની અપાતી નોટીસ, બંધ રહેનારી ફેકટરીઓ.

ઓહો! આખરે જે ધારવામાં આવતું હતું તે થયું ખરું જ! ધાર્યું વહેલું હતું. માત્ર સહેજ મોડું થયું છે!

# અનાજની વણસી રહેલી પરીસ્થિતિ

## સસ્તા અનાજની દુકાન ખોલવાની લોકોની માગણી

પળાંસવા

અહીં અનાજની પરીસ્થીતી વણસી રહી છે. પરીણામે અનાજના ભાવો ખુબ જ વધી ગયા છે. લોકોએ તાર દ્વારા ગામમાં સસ્તા અનાજની દુકાન ખોલવાની સત્તાવાળાઓને માગણી કરી છે. છે. અહીં લોકોને બાજરો કળશી ૨૦૦ આસરે પડેલ છે. મોલ સાવ સુકાઈ ગયા છે. ખેડુતો દુષ્કાળ પ્રવર્તતાં ભારે ચીંતામાં પડયા છે.

## પટેલના નાક, કાન કપાયા

### બદલ થયેલી ધરપકડ

જાટાવાડા

અત્રેના પોલીસ પટેલના ગરાશીયાએ નાક કાન કાપી લીધા હોવાથી રાપરથી ફોઝદાર અને પોલીસ આવ્યા હતા અને પાંચેક ગરાશીયાઓની ધરપકડ કરી રાપર લઈ ગયા હતા.

## પઈસા દીધે બાજરો મળતો નથી

### માગણી છતાં તકાવી મળી નથી

કીડીયાનગર

અત્રે અખીલ વાગડ સેવા મંડળના પ્રમુખ શ્રી જાદવજીભાઈ મોરબીઆ આવ્યા હતા. અંતે તેમણે રાત્રે સભા ભરી વર્તમાન પરીસ્થીતી પર પ્રવચન કરી વાગડ સેવા મંડળનો ધ્યેય અને ઉદેશ સમજાવ્યો હતો. અહીં કને અનાજની ભારે ખેંચ વર્તાઈ રહી છે. લોકોને પઈસા દીધે પણ બાજરો મળતો નથા એવી ફરીયાદ થઈ હતી. જ્યારે કેટલાક ખેડુતોઓ નવા કુવા તઈયાર કર્યા છે. તેની તકાવીની માગણી છતાં મળી નથી એટલે લોકોએ કાયદેસર સબસીડી અપાવવા માગણી કરી હતી. જેની શ્રી મોરબીઆએ નોંધ લાધી હતી. આ ગામમાં ૩૫ સભ્યો નોધાયા હતા. અહીંથી શ્રી મોરબીઆ અને તેમની સાથે પરમાર દુદા ભેમરા તથા ભોપા મહાદેવ કારા ધાણીથર તરફ ઉપડી ગયા હતા.

## અનિયમીત બનતી ટ્રેન

### રાત્રે લાઈટ વિના મુસાફરોને નડતી મુશ્કેલી

અંજાર

તા. ૨૫ મીના કંડલાથી ભુજ જતી ટ્રેન પંદર મીનીટ મોડી ભુજ પહોંચવાથી તેમજ અંજાર આવતી આર. એમ. સી. ફેલ જવાથી રાતના દોઢ કલાક મોડી આવેલી. સ્ટેશન પર ટાંગાઓ હાજર ન હોવાથી પેસેન્જરોને ખુબ જ તકલીફ ભોગવવી પડેલી.

ગઈ કાલે ભચાઉથી અંજાર આવતી ટ્રેન કે જે સાડાદશ વાગે આવવી જોઈએ તે ટ્રેનનું એન્જીન ફેલ જવાથી અઢી વાગે અંજાર આવેલ ત્યાંથી છુટા થઈ રાતના સાત વાગે આ ટ્રેન આવેલ ને આઠ વાગે આ ટ્રેન ભચાઉ તરફ રવાની કરેલ જે રાતના દશ સાડાદશે ભચાઉ પહોંચેલ આ ટ્રેનના ડબામાં બત્તીની સગવડ ન હોવાથી પેસેન્જરોને ભારે તકલીફ ભોગવવી પડી હતી. ટ્રેનના એન્જીનમાં પણ બત્તી ન હોવાથી કાનસથી આ પેસેન્જર ટ્રેન ભચાઉ પહોંચેલ રાતના ટ્રેનો વગર લાઈટે ન દોડે તેવો રેલ્વે કાયદો હોવા છતાં કચ્છમાં અંધારે ચલાવાય છે.

## નખત્રાણાના કોંગરેસી ઉપર ફરમાવાયલું વોરંટ

### જુદા જુદા મુકાયલા આક્ષેપ

નખત્રાણા,

નખત્રાણાના ફ. ક. મેજીસ્ટ્રેટ શ્રી. વઈધ સમક્ષ કલ્યાણપર ગામના પટેલ શ્રી. શીવગણ ભીમજીએ નખત્રાણાવાળા કોંગ્રેસી શ્રી નથુ નાનજી વગેરે પાંચ જણ ઉપર ગાળાગાળી, મારામારી, કાયદા વીરૂધ્ધ મંડળી વીગેરે તહોમતો મુકતી ફરીયાદ કરતાં ના. અદાલત તરફથી આરોપીઓ ઉપર વોરંટ કાઢવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.

કયુમા લોશન
દાદર માટેનો અચુક ઇલાજ કપડા પર બીલકુલ ડાઘ પડતા નથી
કચ્છનાં એજન્ટઃ-પુરૂષોતમ તુલસીદાસ રામજી માંડવી (કચ્છ)

કચ્છના ગામેગામના સમાચારો
બીજા કોઇ પણ પત્ર કરતાં વધુ
અને સઉથી પહેલાં પુરાં પાડતાં
કચ્છનાં એક માત્ર પત્રો
દઈનીક અને સાપ્તાહિક

[કચ્છમાં પ્રસીદ્ધ થતા કે વહેંચાતા બીજા કોઇ પણ પત્ર કરતાં વધુ વેચાણ અને ફેલાવો ધરાવતું પત્ર]

લવાજમ

| દઈનીક | | સાપ્તાહિક |
|---|---|---|
| વાર્ષીક રૂા. | ૩૩ | રૂા. ૬ |
| ૭ માસીક રૂા. | ૧૭ | ભુજમાં દઈનીક અને સાપ્તાહીકનું |
| ત્રીમાસિક ,, | ૯ | માસીક લવાજમ રૂા. ૩-૧૪-૭ |

વ્યાપાર, કોર્ટ કચેરીઓ અને અન્ય જાહેર ખબરો માટે
પત્રવ્યવહારનું સરનામું
-: વ્યવસ્થાપક :-
આઝાદ કચ્છ કાર્યાલય
ભુજ—કચ્છ

કેસમેમો બુક
રેશન સોપ ચલાવનારા માટે કોરી, છાપેલી અને નામ વાળી ૮ ૧૦, ૧૨ ની સાઈઝની તઈયાર બુકો માટે
મળો યા લખો
વ્યવસ્થાપક
પ્રવીણ પ્રિન્ટરી
ભુજ : કચ્છ

realpatidar.com

https://archive.org/details/bk787/page/n5/mode/1up

1951-10-03 -Azad Kutch -Newspaper (787)

realpatidar.com

કચ્છી પ્રજા અને કચ્છીઓનું પ્રથમ દૈનિક

આઝાદ કચ્છ

કચ્છની જનતાનું પ્રગતિશીલ પત્ર: તંત્રી: પ્રાણલાલ શાહ

પત્ર વ્યવહારનું સરનામું: આઝાદ કચ્છ કાર્યાલય: ભુજ: કચ્છ. તાર: AZADKUTCH BHUJ

લવાજમ
દૈનિક વાર્ષિક ૩૩-૦
છ માસિક રૂ. ૧૭-૦-૦
ત્રિમાસિક ૯-૦-૦
સાપ્તાહિક
વાર્ષિક રૂ. ૬-૦-૦
આઝાદ કચ્છ કાર્યાલય
ભુજ કચ્છ

# શ્રીમંત હોઇ મને પોલિસે સંડોવ્યો છે

## નખત્રાણા મેજીસ્ટ્રેટે રદ કરેલા જામીન એક શ્રીમંત સુધારકનો અદાલત સમક્ષ પોકાર

નખત્રાણા

પોલીસ મને પઈસાદાર હોઇને આ પ્રકરણે ખોટી રીતે સંડોવ્યો છે. મારી સામે કોઇ પુરાવો નથી તેમજ મારા સામે સામાવાળાએ પણ કોઇ અરજ કરી હોય તો તે માગ્યા છતાં પોલીસ બતાવતી નથી. મારી સામે સામાવાળાએ પણ કશી જ ફરીયાદ કરી નથી પોલીસ અમલદારે મને પઇસાદાર જાણી સંડોવ્યો છે.

ઉપરના મતલબે પોલીસ સામે નખત્રાણા અદાલત સમક્ષ વીરાણીના પટેલ રતનસી ખીમજી જેઓ સનાતની પાટીદારોના લોકમાન્ય ક્રાન્તીચાહક શ્રીમંત સુધારક છે તેમણે રજુઆત કરી પોતાનાં જામીન રદ કરતા અરજ ગુજારી હતી. શ્રી. રતનશી-ભાઇનાં વકીલ રામજી હાવડાએ પોલીસનાં ગેરકાયદે અને પુરાવા વીનાનાં કૃત્યોની રજુઆત કરી કેટલાક કાયદાનાં આધારો રજુ કર્યાં હતાં.

અદાલતનાં ન્યાયમુર્તિ શ્રી પ્રાણ-લાલ એચ. વઇદે શ્રી રતનશીનાં લેવાયલા મોટી રકમના જામીન અને મુચરકા રદ કરતાં જણાવ્યું હતું કે પોલીસ તરફથી કોઇ હાજર થતું નથી. તેમ તેનાં તરફથી આ પ્રકરણે કંઇ અરજો થઇ હોય તો તે અરજો પણ રજુ થતી નથી. પોલીસ તરફથી આ અરજદાર વીરુધ્ધ ખાસ સ્પેસીફીક કોઇ પુરાવો પ્રાથમીક રજુ થયો નથી આ તમામ હકીકત ધ્યાનમાં લઇ, તેમ અરજદાર તરફથી મુળ જામીનની અરજીની નકલ મીસલમાં આવેલ છે. એ અરજીની નકલ પણ હજી પોલીસ તરફથી આપવામાં આવી નથી આ કેસ ની કેટલાક દરાવો જોતા આ જવાબદાર વીરુધ્ધ અરજનો નીકાલ થતા દરમ્યાન લેવાએલ જામીન ચાલુ રાખવા કંઇ કારણ પોલીસ તરફથી બતાવવામાં આવતું નથી તેનો જવાબ તદ્દન મોજુદ છે. માટે સામાવાળા રતનસી ખીમજીના જે દરમ્યાન જામીન તથા હાથ મુચરકા લેવાયલ છે. તે આથી રદ કરવામાં આવે છે.

શ્રી રતનશી ખીમજી સામે આ પ્રકરણ પોલીસ ઇન્સ્પેકટર સાહેબશ્રીની ફરીયાદથી કરવામાં આવ્યું હતું.

## ભુઠી પીરનાં મેળામાં

### જુગાર અને દારૂ?

ગઢસીસા

અત્રે રામેતા મુજબ ભુઠી પીરનો મેળો ભરવામાં આવ્યો હતો. આ મેળામાં કહેવાય છે કે પોલીસની નીગેહબાની નીચે જુગારના અખાડા ચાલી રહયા હતા. તેમજ દારૂના બાટલાઓનો પણ છડેચોક વપરાસ થઇ રહયો હોવાનુ કહેવાય છે.

## કચ્છનાં લોકલ બોર્ડની થનારી રચના

### કુલ્લે ત્રીસ સભ્યો ચુંટવામાં આવશે

કચ્છ માટેના લોકલ બોર્ડની રચના અંગે તાલુકા વાર સભ્ય સંખ્યા નીયત કરાઇ ગઇ છે. સમગ્ર કચ્છ માટે એક લોકલ બોર્ડ રહેશે અને તેનું વડું મથક ભુજમાં રહેશે.

આ લોકલ બોર્ડનાં ત્રીશ સભ્યો કચ્છનાં જુદા જુદા નવ મતદાર વીસ્તારમાંથી ચુંટવામાં આવશે.

ભુજ, માંડવી અને નખત્રાણા મતદાર વીભાગની બેઠકોમાંથી એકેક સ્ત્રીઓ માટે અનામત રહેશે. ત્યારે રાપરમાંથી હરીજનો માટે એક બેઠક અનામત રહેનાર છે.

ભુજ માંડવી, મુંદરા અને અંજાર તાલુકામાં મ્યુનીસીપાલીટીનાં વીસ્તાર સીવાયનાં મતદાર વીભાગમાંથી ભુજ બન્ની ખાવડા સહીત ચાર સભ્યો માંડવી તાલુકે ચાર સભ્યો, અંજાર તાલુકે ત્રણ સભ્ય, મુંદરા તાલુકે ત્રણ સભ્યો, અબડાસો ત્રણ સભ્યો, નખત્રાણા તાલુકે ચાર સભ્ય, ભચાઉ-આધોઇ મહાલ સહીત ત્રણ સભ્યો, રાપર ખડીર મહાલ સહીત પાંચ સભ્યો અને અને લખપત એક સભ્ય રહેશે.

## પાટનગરના વીદ્યાથીઓએ ઉજવેલી ગાંધી જયંતી

ભુજ, તા. ૨

પાટનગર ભુજની આલ્ફ્રેડ હાઇસ્કુલ તેમજ ઇન્દ્રાબાઇ ગર્લ્સ સ્કુલનાં વીદ્યાર્થીં વીદ્યાર્થીનીઓએ રસપુર્વક ગાંધી જયંતી ઉજવી હતી.

આલ્ફ્રેડ હાઇસ્કુલમાં વીદ્યાર્થીઓએ પર્ણકુટીર બનાવી હતી, કેળવણી વડા શ્રી નાણાવટીએ આ પ્રસંગે હાજરી આપી વીદ્યાર્થીઓને ઉદબોધન કર્યું હતું.

કાંતણ તેમજ બીજા કાર્યક્રમમાં વીદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હરીજન છાત્રાલય વીદ્યાર્થીઓએ પણ પ્રાર્થના, સમુહ કાંતણ અને અખંડ રેંટીયો ચાલુ રાખ્યો હતો.

જાહેર ખબર માટે
ઉતમ સાધન
'આઝાદ કચ્છ'

કચુમા મલમ
દરેક જાતની ખસ, ખુજલી તથા ચામડીના રોગો પર આકસીર
મેસર્સ પુરસોતમ તુળસીદાસ રામજી દવાવાળા માંડવી, કચ્છ

## વેપાર સમાચાર

### મુંબઇ બજાર ભાવ બંધ

તા. ૨-૧૦-૫૧

| | |
|---|---|
| ચાંદી તઇયાર ... ... | |
| સોનું તઇયાર ... ... | |
| એરંડા ... ... ... | |
| ,, વાયદા ... ... | |
| મે ,, ... ... | |
| મગફળી ... ... ... | |
| કાળસી ... ... ... | |
| અળસીનું તેલ ... ... | |

### કચ્છ માંડવી

તા. ૨-૧૦-૫૧

| | |
|---|---|
| બાજરો | ૧૯ાા-૨૦ |
| ગુવાર દેશી | |
| ગુવાર પંજાબી | ૧૮ાા |
| મગ દેશી | ૨૪-૨૫ |
| ,, મુગલાઇ | ૨૪ |
| ,, ચીનાઇ | ૨૪ાા |
| હોરડ | ૧૫-૧૬ |
| ચોખા બસરાઇ | ૩૩-૩૩ાા |
| ,, ઊંચા | ૫૭-૫૮ |
| ઘઊં શરબતી | ૩૨-૩૪ |
| ચણાદાર | ૨૬ાા-૨૭ |
| ચણા | ૨૨-૨૫ |
| મગદાર | ૩૩-૩૪ |
| તુવેરદાર | ૩૪-૩૫ |
| કપાસીયા મુગલાઇ | ૧૫ |
| ,, પોપટા | ૧૫ |
| ખજુર શામરાણુ | ૧૪-૧૭ |
| ,, જાયદી | |
| ખાંડ તઇયાર | ૬૪-૬૬ |
| તેલ મીઠનો | ૨૮ાા |
| તેલ જામનગરી | ૨૮ાા |
| ખડ શીંગદાણાનો | ૧૦ |
| ,, ટોપરાનો | ૧૯ાા |
| સીમેન્ટ A. C. C- | ૫ાાા- |
| ,, D. C C- | ૬ા- |
| કેરોશીન ડબો | ૫ાાા- |
| ભોંયસીંગ | ૧૯-૨૧ |

### વાગડના બજાર ભાવ

તા. ૨-૧૦-૫૧

| | |
|---|---|
| મગ નવા ... ... | ૨૩ |
| હોરડ ... ... ... | ૧૫ |
| ગુવાર ... ... ... ... | ૧૬ાા |
| એરંડા ... ... ... .... | ૨૬ાા |
| મરચાં ... ... ... | ૪૮ |
| કપાસીઆ ... ... ...... | ૧૪ાા |
| ... ... ... ... ... | ...૧૫૫ |
| કઠોળ વાઘાયા | ૨૫ |
| જાર, ગુંદરી, બીજની | ૨૦ |

તંત્રી મુદ્રક, પ્રકાશક શ્રી પ્રાણલાલશાહે પ્રવીણ પ્રીન્ટરી ભુજમાં છપાવી આઝાદકચ્છ કાર્યાલય ભુજમાં પ્રગટ કર્યું"

realpatidar.com